

મિડ-કે

Mumbai

28 May, 2020

શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા સેવા અભિયાન



આજે સમગ્ર વિશ્વ જ્યારે મહામારીના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે 'શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર' તેના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની પ્રેરણાથી સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને અનેક સ્તરે રાહતકાર્યો કરી રહ્યું છે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો શરૂ થયા બાદ મુંબઈભરમાં શ્રમિકોનો રેલવે સ્ટેશનો, બસ ડેપો વગેરે પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. કલાકો સુધી ખાધાપીધા વિના લાઈનોમાં ઊભા રહેલા આ શ્રમિકોને તાજાં થેપલા પહોંચાડવા માટે તેમણે 'સર્કલ ઓફ લવ એન્ડ કેર' નામનું એક અનોખું અભિયાન શરૂ કર્યું છે જેમાં તેમને મુંબઈગરાઓનો અકલ્પનીય સપોર્ટ પડ્યો છે. જેમાં ધોમધખતા તાપમાં કલાકો સુધી ઊભા રહેતા પરપ્રાંતીય શ્રમિકોને થેપલા, પાણીની બોટલ, જ્યૂસ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવે છે.